

જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩

કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૩/૦૮/૨૦૧૮ ગુરુવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૬૨૫/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૨ કેસ કરી, ૨૭ વ્યક્તિઓને ઝડપી, ૮૦ લીટર દેશી દારૂ, ૧૨ બોટલ ઇંગ્લીશ દારૂ, ૨૮ ક્વાર્ટર ઇંગ્લીશ દારૂ, ૦૪ બીયરટીન કબજે કર્યા હતા. તેમજ જુગાર ધારા હેઠળ ૦૭ કેસ કરી ૨૯ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૬૧,૯૧૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૬૨૬/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૯૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી ૯૩ મુજબ ૦૧ વ્યક્તિની અને પાસા હેઠળ ૦૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડી અને વિશ્વાસઘાત :-

સમાચાર યાદી નં.૧૬૨૭/૧૮

સોલા હાઇકોર્ટ : (૧) દર્શનાબહેન એરીકભાઈ સુવેરા (રહે, બ.નં.૧૫, સુર્યોદય બંગલોઝ, ગુલાબ ટાવર પાસે થલતેજ) એ તા.૨૨/૮/૧૮ નારોજ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે જુલાઈ માસમાં દર્શનાબહેને પોતાને વી.એસ.હોસ્પિટલમાં પ્રેક્ટીકલ ની પરીક્ષા હોય પોતાની સોનાની ચેઇન અને સોનાની બુટ્ટી આરોપી અલકાબહેન ભરતભાઈ પટેલ (રહે, બ.નં.૧૭ સુર્યોદય બંગલોઝ ગુલાબ ટાવર પાસે થલતેજ) ને રાખવા માટે આપેલ અને તા.૦૭/૦૮/૨૦૧૮ ના રોજ પરીક્ષા પુરી થતા ઘરે જવાનું હોઇ, સોનાની ચેઇન તથા સોનાની બુટ્ટી માંગતા, ફક્ત સોનાની બુટ્ટી પરત આપેલ અને સોનાની ચેઇન કિંમત રૂપિયા ૨૯,૦૦૦/- પરત નહીં આપી, છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી બી.એમ.પરમાર ચલાવે છે.

સોલા હાઇકોર્ટ : (૨) શારદાબહેન કાંતીભાઈ પટેલ (રહે, વિશ્વાસ સીટી, શાયોના સીટી સામે ચાણક્યપુરી ઘાટલોડીયા) એ તા.૨૨/૮/૧૮ નારોજ સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે આશરે દોઢેક વર્ષ પહેલા થી આજદિન સુધીના સમયગાળા દરમ્યાન આરોપી ભાવીનભાઈ રમેશભાઈ દવે(ઓફિસ: એક્સીસ બેન્ક ઘાટલોડીયા બ્રાંચ) એ શારદાબહેન જ્યારે ગોલ્ડ લોન ખાતામાં પૈસા ભરવા જતા હતા ત્યારે “લાઇનમાં ઉભુ ન રહેવું હોય તો પૈસા અને ચેકો આપી જાય જે તમારા લોનના ખાતામાં ભરી દઇશ” તેમ કહી, શારદાબહેનને વિશ્વાસમાં લઇ, તેમની પાસેથી ચેકો તથા રોકડ રૂપિયા મળી આશરે રૂપિયા ૪,૮૬,૩૦૦/- લઇ, શારદાબહેનના લોન ખાતામાં નહી ભરી તથા ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરી અંદાજીત રૂપિયા ૧,૨૫,૦૦૦/- ના વ્યવહારો કરી, આજદિન સુધી શારદાબહેનના લેવાના નીકળતા કુલ રૂપિયા આશરે ૬,૧૧,૩૦૦/- પરત નહી કરી, શારદાબહેન સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.યુ.પાડવી ચલાવે છે.

કૃષ્ણનગર : નરેશભાઈ ભગવાનદાસ મોટવાણી (ઉ.વ.૨૯)(રહે, પહેલો માળ આદર્શ ગલી ઠક્કરબાપાનગર કૃષ્ણનગર) એ તા.૨૨/૮/૧૮ નારોજ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૫/૭/૧૮ થી આજદિન સુધીના સમયગાળા દરમ્યાન ઠક્કરનગર રોડ રતનબા સ્કુલ રોડ હરેકૃષ્ણ ફ્લેટ બીજો માળ મકાન નંબર-૯ ખાતે આરોપી (૧) વિનોદભાઈ ચતુરમલ મીરચંદાણી (રહે, રતનરાજ ફ્લેટ, ચિલોડા નરોડા) અને (૨) કિશોર ચતુરમલ મીરચંદાણી (રહે, હરેકૃષ્ણ ફ્લેટ બીજો માળ રતનબા સ્કુલ રોડ ઠક્કરનગર કૃષ્ણનગર) એ ભેગામળી જય માતાજી મિત્ર મંડળ ની હપ્તા ભરવાની સ્કીમ માં “રૂપિયા ૨૫૦૦/- ના ૨૦ હપ્તા ભરાવી એક્ટીવા ૪-જી વસાવો” તેવી સ્કીમ નું આયોજન કરેલ. જે સ્કીમમાં નરેશભાઈ એ કુલ ૧૧ હપ્તા લેખે ૨૭,૫૦૦/- ભરેલ અને આ સિવાય બીજા ૯૯ સભ્યો આ સ્કીમમાં હતા. જે સ્કીમના કુલ ૧૨ ડ્રો કર્યા બાદ કોઈ ડ્રો નહીં કરી અને સભ્યો ના નાણા પરત નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી પી.કે.દવેરા ચલાવે છે.

લુંટ :-

સમાચાર યાદી નં.૧૬૨૮/૧૮

સરદારનગર : દિવ્યેશભાઈ સુનિલભાઈ થદાણી (રહે, સાધુ વાસવાણી સોસાયટી, મહારથી સોસાયટી ની અંદર સરદારનગર) એ સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૨/૦૮/૧૮ રાતના ૯/૦૦ વાગ્યાના સુમારે શ્યામસુંદર બેકરી પાસે, માયા સિનેમા રોડ ઉપર દિવ્યેશભાઈ પોતાનું એક્ટીવા ચલાવી પસાર થઈ રહ્યા હતા દરમ્યાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ દિવ્યેશભાઈના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૪૦,૦૦૦/- મતાની તેમજ રાતના ૯/૩૦ વાગ્યાના સુમારે મહાવિર કસરત શાળા સામે રોડ ઉપર થી પસાર થઈ રહેલ મનીષાબહેન વા/ઓ સુનિલકુમાર મખીજા (રહે. જાહન્વી એપાર્ટમેન્ટ સૈજપુર) ના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૪૦,૦૦૦/- ખેંચી તોડી લઈ નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એમ.એમ.ઠાકોર ચલાવે છે.

નજર ચુકવી ચોરી:-

સમાચાર યાદી નં.૧૬૨૯/૧૮

નવરંગપુરા : ગીરીશભાઈ કાન્તીલાલ પટેલ (ઉ.વ.૬૦)(રહે, જગતદર્શન સોસાયટી, રામજી મંદિર રોડ, રાણીપ) એ નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૧/૦૮/૧૮ સાંજના ૫/૧૫ વાગ્યાના સુમારે નવરંગપુરા, ઇશ્વરભુવન બસ સ્ટેન્ડ પાસે આવેલ બંગલાના ગેટ આગળ રોડ ઉપરથી પોતાના એક્ટીવા સાથે હાજર હતા દરમ્યાન બે મોટર સાયકલ ઉપર આવેલ ત્રણ અજાણ્યા ઇસમોએ ભેગામળી ગીરીશભાઈની નજર ચુકવી તેમના એક્ટીવાની ડેકીમા મુકેલ સોનાની હીરા જડીત બુટ્ટી કિંમત રૂપિયા ૪૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૬,૦૦૦/- અને રોકડ રૂપિયા ૧,૫૦૦/- મળી કુલ રૂપિયા ૪૭,૫૦૦/- મતાની ચોરી કરી લઈ ગયા છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એ.એ.ચ.કાઝી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.